

# Raghunandji Ni Dwarke Je Nathji Song Lyrics

---

Aarati raghunandjini dwarike je nathji  
Tame bolo sahja aarati  
Aarati raghunandjini dwarike je rayji  
Tame bolo sant aa aarati

Pratham pela pend rachiya  
Pratham pela pend rachiya  
Pavan pani bandh di  
Akhut roti purse bavo akhut roti purse  
E puthvi navkhand di

Aarati raghunandjini dwarike je nathji  
Tame bolo sahja aarati

Dashrath ghare ramchandra janmiya  
Seviya vanvas ji  
Dashrath ghare ramchandra janmiya  
Seviya vanvas ji  
Raja ravan mariyo aene rano ravan mariyo  
Bandhya pattharna bandh di  
Tame bolo sahja aarati

Ajmal gher ramdev padharya  
Sevya drarika nathji  
Ajmal ghare ramdev padharya  
Sevya drarika nathji  
Drarike me call didhya  
Drarike me call didhya  
Paya pokarn may ji  
Tame bolo sahja aarati

Aarati raghunandjini dwarike je rayji  
Tame bolo sant aarati

Vasudev ghare kan janmiya  
Dori ubho vardhanji  
Vasudev ghare kan janmiya  
Dori ubho vardhan ji

Mama kansh ne mariyo aene mama kansh ne mariyo  
Jitya mathurama jang ji  
Tame bolo sachi aarati

Rushmanina kankan bhariya  
Rushmanina kankan bhariya  
Gurjari bahu rang ji  
Rukmanin kankan bhariya  
Rukmanin kankan bhariya  
Bharatlyrics.com  
Gurjari bahu rang ji  
Gopiyome kano pyara  
Gopiyome kano pyara  
Nir chhe bad gangaji  
Tame bolo sahja aarati

Sant sudharan parcha dharan  
Sant sudharan parcha dharan  
Sambhodo sant aarati  
Bhakt sudamani vinanti  
Aa bhakt sudamani vinanti  
Tame manilo govindji  
Tame bolo sahja aarati

BHARAT  
lyrics

Aarati arghunandji ranchhod rajarayji  
Di fakiri hanuman ni  
Tame bolo sahja aarati  
Tame bolo sahji aarati  
Sau bolo aa sahji aarati.

More Lyrics from [Geeta Ben Rabari Official](https://bharatlyrics.com/geeta-ben-rabari-official/)

## રઘુનંદજી ની દ્વારકે જે નાથજી Lyrics In Gujarati

આરતી રઘુનંદજીની દ્વારકે જે નાથજી  
તમે બોલો સાજા આરતી  
આરતી રઘુનંદજીની દ્વારકે જે રાઘજી  
તમે બોલો સંત આ આરતી

પ્રથમ પેલા પેન્ડ રચીયા

પ્રથમ પેલા પેન્ડ રચીયા  
પવન પાણી બંધ દી  
અખૂટ રોટી પૂરશે, બાવો અખૂટ રોટી પૂરશે  
ઈ પુષ્ટી નવમંડ દી

આરતી રઘુનંદજી ની દ્રારીકે જે નાથજી  
તમે બોલો સાજા આરતી

દશરથ ઘરે રામચંદ્ર જનમિયા  
સેવિયાં વનવાસ જી  
દશરથ ઘરે રામચંદ્ર જનમિયા  
સેવિયાં વનવાસ જી  
રાજા રાવણ મારીયો એને રાણો રાવણ મારીયો  
બાંદ્યા પથ્થરના એ બંધ દી  
તમે બોલો સાજા આરતી

અજમલ ઘરે રામદેવ પધાર્યા  
સેવ્યા દ્રારિકા નાથજી  
અજમલ ઘરે રામદેવ પધાર્યા  
સેવ્યા દ્રારિકા નાથજી  
દ્રારીકે મેં ક્રોલ દીધા  
દ્રારીકે મેં ક્રોલ દીધા  
પાયા પોકરણ માય જી  
તમે બોલો સાજા આરતી

આરતી રઘુનંદજીની દ્રારીકે જે રાજજી  
તમે બોલો સંત આરતી

વાસુદેવ ઘરે કાન જનમિયા  
દોરી ઉભો વર્ધનજી  
વાસુદેવ ઘરે કાન જનમિયા  
દોરી ઉભો વર્ધનજી  
મામા કંશને મારીયો એને મામા કંશને મારીયો  
જીત્યા મથુરામાં જંગ જી  
તમે બોલો સાચી આરતી

રુક્મણિના કંકણ ભરિયા  
રુક્મણિના કંકણ ભરિયા  
ગુર્જરી બહુ રંગ જી  
રુક્મણિના કંકણ ભરિયા  
રુક્મણિના કંકણ ભરિયા  
ગુર્જરી બહુ રંગ જી  
ગોપીયોમેં કાનો પ્યારા  
ગોપીયોમેં કાનો પ્યારા  
નીર છે બડા ગંગાજી  
તમે બોલો સાજા આરતી

BHARAT  
lyrics

સંત સુધારણા પરચા ધારણા  
સંત સુધારણા પરચા ધારણા  
સાંભળો સંત આરતી  
ભક્ત સુદામાની વિનંતી  
આ ભક્ત સુદામાની વિનંતી  
તમે માનીલો ગોવિંદજી  
તમે બોલો સાજા આરતી

આરતી રઘુનંદજી રણાણોડ રાજારાચની  
દી ફકીરી હનુમાન ની  
તમે બોલો સાજા આરતી  
ભારતવીરીકસ.કોમ  
તમે બોલો સાજા આરતી  
સૌ બોલો આ સજા આરતી.

More Lyrics from [Geeta Ben Rabari Official](#)

BHARAT  
lyrics